

**B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination
March/April-2026 (NEW COURSE)
Indirect Tax Law - 1(Dse-3)**

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ પરોક્ષ કર એટલે શું? તેની લક્ષણીકતાઓ વર્ણવો. (૨૦)
અથવા
- પ્રશ્ન.૧ ભારતમા GST ની જરૂરીયાતોની ચર્ચા કરી તેની બંધારણી જોગવાઈઓ વર્ણવો.
- પ્રશ્ન.૨ સંયુક્ત પુરવઠો અને મિશ્ર પુરવઠો નોંધ લખો. (૨૦)
અથવા
- પ્રશ્ન.૨ GST કંપોઝીઝણ સ્કીપના ફાયદા અને મર્યાદા જણાવો.
- પ્રશ્ન.૩ ફોરવર્ડ ચાર્જ અન્વયે વસ્તુના સમયનો પુરવઠો સમજાવો. (૧૫)
અથવા
- પ્રશ્ન.૩ ફોરવર્ડ ચાર્જ અન્વયે સેવાના સમયનો પુરવઠો સમજાવો.
- પ્રશ્ન.૪ કિંમત પુરવઠા અન્વયે નીચેના પર નોંધ લખો. (કોઈ પણ બે) (૧૫)
(1) વ્યવહારનું મુલ્ય. (3) એજન્ટ
(2) નાણું. (4) અવેજ

ENGLISH VERSION

- Que.1 What is Indirect tax? Describe its features. (20)
OR
- Que.1 Discuss need for GST in India describe its Constitution Provision.
- Que.2 Write a note on composite supply and mixed supply. (20)
OR
- Que.2 State merits and demerits of composition scheme under GST.
- Que.3 Explain time of supply of Goods under forward charge. (15)
OR
- Que.3 Explain time of supply of service under reverse charge.
- Que.4 Write a note under value of supply. (Any Two) (15)
(1) Transaction value. (3) Agent.
(2) Money. (4) Considerations.
